

ઓગસ્ટ 27, 2018

## સીટી ઓફ બ્રામ્પટનમાં લેબર ડે 2018

બ્રામ્પટન સીટી હોલ સોમવાર, સપ્ટેમ્બર 3 નાં રોજ લેબર ડે માટે બંધ રહેશે. સંખ્યાબંધ શહેરી સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાયસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, પાર્કિંગ ટંડ ચૂકવી શકશે નહિ, અથવા પરમીટ્સ મેળવવા અરજી કરી શકશે નહીં. ઓનલાઇન વિકલ્પો માટે કૃપા કરી વેબસાઇટ જુઓ, [brampton.ca](http://brampton.ca)

સંખ્યાબંધ સેવાઓ રાખેતા મુજબ ચાલુ રહેશે, જેમાં સામેલ છે: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (અગ્નિશમન અને કટોકટી સેવાઓ) અને બાય-લો એન્ફોર્સમેન્ટ (નિયમોની અમલ-બજવાણી). સીટી ઓફ બ્રામ્પટનની સેવાઓમાં ફેરફારો અને સેવા બંધ રહેવાને સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરી 311 નંબર પર ફોન કરો અથવા વેબસાઇટ જુઓ, [brampton.ca](http://brampton.ca)

### બ્રામ્પટન ટ્રાન્ઝિટ લેબર ડે અઠવાડિક રજાઓનું સમયપત્રક:

- શુક્રવાર, ઓગસ્ટ 31: અઠવાડિક દિવસની નિયમિત સેવા
- શનિવાર, સપ્ટેમ્બર 1: શનિવારની નિયમિત સેવા
- રવિવાર, સપ્ટેમ્બર 2: રવિવાર/જાહેર રજાની નિયમિત સેવા
- સોમવાર, સપ્ટેમ્બર 3: રવિવાર/જાહેર રજાની સેવા

ટ્રાન્ઝિટ સ્ટોર્સ સોમવાર, સપ્ટેમ્બર 3 નાં રોજ બંધ રહેશે.

માર્ગ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઇટ [bramptontransit.com](http://bramptontransit.com) જુઓ અથવા રિયલ-ટાઇમ (વાસ્તવિક સમયે) તમારા મોબાઇલ સાધન વડે બસ માહિતી મેળવવા વેબસાઇટ [nextride.brampton.ca](http://nextride.brampton.ca) જુઓ.

### પાર્ક્સ (ઉદ્યાનો) અને રિક્રિએશન (મનોરંજન)

મોટા ભાગની મનોરંજન સગવડો સિવિક હોલીડે વીકએન્ડ દરમિયાન ખુલ્લી રહે છે. કૃપા કરી તમારા સ્થાનિક મનોરંજન કેન્દ્રને (રિક્રિએશન સેન્ટરને) ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા [ઓનલાઇન](http://brampton.ca) વેબસાઇટ જોઈને કાર્યક્રમનું સમયપત્રક પાકું કરો. કૃપા કરી નોંધી લેશો કે પ્રોફેસર્સ લેક અને અલડોરાડો પૂલમાં સ્પ્રે પેડ્સ, વૉડિંગ પૂલ્સ અને સ્વીમિંગનો આનંદ માણવા લેબર ડે છેલ્લી અઠવાડિક રજાનો દિવસ છે.

આપણાં શહેરની રિક્રિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ સોમવાર, સપ્ટેમ્બર 3 નાં રોજ બંધ રહેશે.

### આતશબાજી સુરક્ષા

લેબર ડે પર સીટી ઓફ બ્રામ્પટન દ્વારા આતશબાજી કાર્યક્રમનું આયોજન થતું નથી.

લેબર ડે વર્ષના ચારમાંનો એક દિવસ નથી જ્યારે સીટી ઓફ બ્રામ્પટનમાં અંગત આતશબાજીની છૂટ આપવામાં આવતી હોય. વધુ માહિતી માટે 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઇટ જુઓ, [brampton.ca/bylaws](http://brampton.ca/bylaws)

### બ્રામ્પટન લાઇબ્રેરી

બ્રામ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ (સિવિક સેન્ટરમાં ચિંગકુસી, સીરિલ ક્લાર્ક, ફોર કોર્નેર્સ, ગોર મેડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સિંગ્રાઉલ અને સાઉથ ફ્લેચર્સ) સપ્ટેમ્બર 3 નાં રોજ લેબર ડે પર બંધ રહેશે. વધુ માહિતી માટે, 905.793.4636 અથવા 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઇટ જુઓ, [bramptonlibrary.ca](http://bramptonlibrary.ca)

